

INDIAN
EXPRESS
GROUPTHE
LATEST
TRENDS
IN
BUSINESSTHE
LATEST
TRENDS
IN
TRENDSFINANCIAL EXPRESS
Read to Lead

DESCO INFRATECH LIMITED

CIN: U45201GJ2011PLC063710

This is a public announcement for information purposes only and is not a prospectus announcement and does not constitute an invitation or offer to acquire, purchase or subscribe to securities. This public announcement is not intended for publication or distribution, directly or indirectly outside India

Our Company was originally incorporated under the name “*Desco Infratech Private Limited*” under the provisions of the Companies Act, 1956 vide Certificate of Incorporation dated January 19, 2011, issued by the Registrar of Companies Gujarat. Subsequently, the status of the Company was changed to public limited and the name of our Company was changed to “*Desco Infratech Limited*” vide Special Resolution passed by the Shareholders at the Extra Ordinary General Meeting of our Company held on June 01, 2024. The fresh certificate of incorporation consequent to conversion was issued on July 26, 2024, by Centralised Processing Centre. For further details on incorporation and registered office of our Company, see “*History and Certain Corporate Matters*” beginning on page 190 of the Red Herring Prospectus.

Registered Office: A-703, Swastik Universal, Next to Valentine Theatre, Dumas Road, Umra, Surat, Gujarat- 395007 India;
Tel: +91 7574 999 097 | E-mail: investors@descoinfra.co.in | Website: www.descoinfra.co.in
Contact Person: Ms. Gandharva Javanika, Company Secretary and Compliance Officer

THE PROMOTERS OF OUR COMPANY ARE MS. INDIRABEN PRUTHUBHAI DESAI, MR. PANKAJ PRUTHU DESAI, MS. HINA PANKAJ DESAI, MR. MALHAR P DESAI AND MR. SAMARTH PANKAJ DESAI

THE ISSUE

PUBLIC ISSUE OF 20,50,000* EQUITY SHARES OF FACE VALUE OF ₹10.00 EACH (THE “EQUITY SHARES”).
*Subject to finalisation of basis of allotment.

DETAILS OF THE SELLING SHAREHOLDERS, OFFER FOR SALE AND WEIGHTED AVERAGE COST OF ACQUISITION
- Not Applicable as the entire issue constitutes fresh issue of equity shares.

PRICE BAND: ₹ 147.00 to ₹ 150.00 PER EQUITY SHARE OF FACE VALUE OF ₹ 10.00 EACH

THE FLOOR PRICE IS 14.7 TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES AND THE CAP PRICE IS 15.0 TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES.

THE PRICE TO EARNING RATIO BASED ON DILUTED EPS FOR FY 2023-24 AT THE FLOOR PRICE IS 21.15 TIMES AND AT THE CAP PRICE IS 21.58 TIMES.

BIDS CAN BE MADE FOR A MINIMUM OF 1,000 EQUITY SHARES AND IN MULTIPLES OF 1,000 EQUITY SHARES THEREAFTER.

ISSUE
PROGRAM

ANCHOR BID/ISSUE OPENS ON: FRIDAY, MARCH 21, 2025
OPENS ON: MONDAY, MARCH 24, 2025
CLOSES ON: WEDNESDAY, MARCH 26, 2025

Our Company is mainly engaged in providing infrastructure and maintenance services to city gas distribution divisions in India. We engage in activities such as pipeline laying, installation, testing, erection and commissioning for Piped Natural Gas (PNG) utilized by both domestic and commercial users and in its operation and maintenance services. Our Company has recently begun offering services in the power distribution projects relating to connectivity, commissioning, and erection of Low Tension (LT) and High Tension (HT) cables, in water distribution projects by offering by designing and constructing water distribution networks, open wells, sump wells, overhead tanks, and well systems and in the renewable energy sector by providing erection of reinforced concrete (RCC) piles for foundational and structural support, along with the installation of structures and solar modules for energy capture.

“THE ISSUE IS BEING MADE THROUGH BOOK BUILDING PROCESS, IN ACCORDANCE WITH CHAPTER IX OF THE SEBI ICDR REGULATIONS (IPO OF SMALL AND MEDIUM ENTERPRISES) AND THE EQUITY SHARES ARE PROPOSED TO BE LISTED ON SME PLATFORM OF BSE LIMITED.”

THE EQUITY SHARES OF THE COMPANY WILL GET LISTED ON SME PLATFORM OF BSE LIMITED. FOR THE PURPOSE OF THE ISSUE, THE DESIGNATED STOCK EXCHANGE SHALL BE BSE.

ALLOCATION OF THE ISSUE

QIB PORTION	NOT MORE THAN 50.00% OF THE NET ISSUE
RETAIL PORTION	NOT LESS THAN 35.00% OF THE NET ISSUE
NON-INSTITUTIONAL PORTION	NOT LESS THAN 15.00% OF THE NET ISSUE
MARKET MAKER PORTION	UPTO 1,07,000 EQUITY SHARES OR 5.22 % OF THE ISSUE

IN MAKING AN INVESTMENT DECISION, POTENTIAL INVESTORS MUST ONLY RELY ON THE INFORMATION INCLUDED IN THE RED HERRING PROSPECTUS AND THE TERMS OF THE ISSUE, INCLUDING THE RISKS INVOLVED AND NOT RELY ON ANY OTHER EXTERNAL SOURCES OF INFORMATION ABOUT THE OFFER AVAILABLE IN ANY MANNER.

The price band is justified based on the qualitative factors, quantitative factors and KPIs disclosed in the chapter titled “*Basis for Issue Price*” beginning on page 129 of Red Herring Prospectus.

CORRIGENDUM TO THE RED HERRING PROSPECTUS DATED MARCH 17, 2025 FILED WITH THE REGISTRAR OF COMPANIES, AHMEDABAD AND SUBMITTED TO SME PLATFORM OF BSE LIMITED (BSE SME) AND SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (SEBI) OF DESCO INFRATECH LIMITED

In this regard, please note the following:

Under the head, “RISK FACTORS” on risk factor no. 30 on the Page No. 61 of the Red Herring Prospectus, the first paragraph of the said risk factor shall be read as:
We intend to use the Net Proceeds for the purposes described in the section titled “Objects of the Issue” on page 116 of this Red Herring Prospectus. The Objects of the Issue comprise of funding of capital expenditure requirements of our Company towards setting up of corporate office in Surat, Gujarat, funding of capital expenditure requirements of our Company towards purchase of machineries, funding working capital requirements and general corporate purposes. We intend to deploy the Net Proceeds in FY 2025-26, such deployment is based on certain assumptions and strategy which our Company believes to implement in future. The funds raised from the Issue may remain idle on account of change in assumptions, market conditions, strategy of our Company, etc., For further details on the use of the Net Proceeds, please refer chapter titled “Objects of the Issue” beginning on page 116 of this Red Herring Prospectus.

Under the head, “OBJECTS OF THE ISSUE- PROPOSED SCHEDULE OF IMPLEMENTATION AND DEPLOYMENT OF THE NET PROCEEDS” on the Page No. 117 of the Red Herring Prospectus, the table shall be read as:

The Net Proceeds of the Issue (“**Net Proceeds**”) are currently expected to be deployed in accordance with the schedule as stated below:

(₹ in lakhs)

Sr. No	Object	Estimated Amount to be financed from Net Proceeds*	Estimated Utilization of Net Proceeds in F.Y. 2025-26*
1.	Funding of capital expenditure requirements towards setting up of corporate office in Surat, Gujarat	104.29	104.29
2.	Funding of capital expenditure requirements towards purchase of machineries	168.04	168.04
3.	Funding Working Capital Requirements of our Company	1,800.00	1,800.00
4.	General corporate purposes*	■	■
Total		■	■

*The amount utilized for general corporate purpose shall not exceed 25% of the gross proceeds of the issue.

*To be updated in the Prospectus prior to filing with RoC

Under the head, “OBJECTS OF THE ISSUE- PROPOSED SCHEDULE OF IMPLEMENTATION AND DEPLOYMENT OF THE NET PROCEEDS” on the Page No. 117 of the Red Herring Prospectus, the second paragraph shall be read as:

Our Company proposes to deploy the entire Net Proceeds towards the aforementioned Objects during Fiscal 2025-26. In the event that the estimated utilization of the Net Proceeds in scheduled fiscal years is not completely met, due to the reasons stated above, the same shall be utilized in the next fiscal year i.e., 2026-27, as may be determined by the Board, in accordance with applicable laws. If the actual utilization towards any of the Objects is lower than the proposed deployment, such balance will be used towards general corporate purposes, to the extent that the total amount to be utilized towards general corporate purposes is within the permissible limits in accordance with the SEBI ICDR Regulations. In case of a shortfall in raising requisite capital from the Net Proceeds or an increase in the total estimated cost of the Objects, business considerations may require us to explore a range of options including utilising our internal accruals and seeking debt lenders. In furtherance, that such alternate arrangements would be available to fund any such shortfalls. Further, in case of variations in the actual utilization of funds earmarked for the purposes set forth above, increased fund requirements for a particular purpose may be financed by surplus funds, if any, available in respect of the other purposes for which funds are being raised in the Issue, subject to compliance with applicable laws.

Under the head, “OBJECTS OF THE ISSUE- DETAILS OF THE OBJECTS OF THE ISSUE” on point - 1. Funding of capital expenditure requirements towards setting up of corporate office in Surat, Gujarat, on the Page No. 119 of the Red Herring Prospectus, the date of payment for purchasing the proposed corporate office shall be updated in the table as: On or before April 10, 2025.

Under the head, “OBJECTS OF THE ISSUE- DETAILS OF THE OBJECTS OF THE ISSUE” on point - 3. Funding Working Capital Requirements of our Company, on Page No. 122 of the Red Herring Prospectus, the first paragraph of the Basis of estimation of incremental working capital requirement details shall be read as:

Our Company proposes to utilize ₹1,800.00 Lakhs of the Net Proceeds in Fiscal 2025-26, respectively towards our Company's working capital requirements. The balance portion of our Company's working capital requirement shall be met from the working capital facilities availed and internal accruals.

Under the head, “OBJECTS OF THE ISSUE- DETAILS OF THE OBJECTS OF THE ISSUE” on point - 3. Funding Working Capital Requirements of our Company, on Page No. 123 of the Red Herring Prospectus, the funding pattern as mentioned in the table shall be read as:

(₹ in lakhs)

Sr. No	Particulars	Audited	Audited	Audited	Audited	Provisional	Provisional
		FY 21-22	FY 22-23	FY 23-24	Period ended September 30, 2024	FY 24-25	FY 25-26
IV	Funding Pattern:						
	IPO Proceeds	---	---	---	---	---	1,800.00

Accordingly, the Red Herring Prospectus, shall stand amended to the extent of and should be read with the above.

The relevant changes shall be reflected in the Prospectus.

All capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the Red Herring Prospectus dated March 17, 2025

For Desco Infratech Limited

Sd/-

Mr. Pankaj Pruthu Desai

Designation: Chairman and Managing Director

DIN: 03344685

Date: March 19, 2025

Place: Surat


AdBaaZ



For All Advertisement Booking

Call : 0120-6651214

IPL 2025 પહેલા શ્રેયસ ઐયરનું છલકાતું દર્દ, કહ્યું- 'આના કારણે મારી બંદનામી...'



(એજન્સી) મુંબઈ | તા. 19

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર આઈપીએલ 2025માં પંજાબ ક્રિસ્ટની કેપ્ટનશીપ સંભાળવા માટે તૈયાર છે. શ્રેયસ ઐયરે ગયા સિઝનમાં ક્લેકકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરી હતી અને ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. પરંતુ KKR એ IPL 2025 માં ઐયરને રિટેન કર્યા ન હતા. હાલમાં તે પંજાબ ક્રિસ્ટની કેપ્ટનશીપ સંભાળવા જઈ રહ્યો છે. પરંતુ સીઝનની શરૂઆત પહેલા, શ્રેયસ ઐયરે પોતાના નિવેદનથી ટ્રોલ્સને યોગ્ય જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. શ્રેયસ ઐયર IPL 2025 માં પંજાબ ક્રિસ્ટની કેપ્ટનશીપ સંભાળશે. તેને આ માટે પોતાની તૈયારી પણ પૂર્ણ કરી લીધી છે. તાજેતરમાં, એક ઈન્ટરવ્યુ દરમિયાન, શ્રેયસ ઐયરને શોર્ટ બોલ સામે તેની નબળાઈ વિશે પૂછવામાં આવ્યું. આના જવાબમાં તેને કહ્યું કે કદાચ આવી છાપ ઊભી થઈ હતી અથવા તેઓ ટાઈટ્સકાસ્ટ હતા. પરંતુ તે હંમેશા પોતાની શક્તિ અને ક્ષમતા વિશે જાણતો હતો અને તેને પોતાના પર વિશ્વાસ હતો. શ્રેયસ ઐયરે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર બેટિંગ કરી હતી. તે શોર્ટ બોલ પર પણ મુક્તપણે શોટ રમ્યો. વર્લ્ડકપ 2023 દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે જ્યારે પત્રકારે તેમને શોર્ટ બોલ વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે શ્રેયસ ઐયર ગુસ્સે થઈ ગયો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે શ્રેયસ ઐયરે શાનદાર પ્રદર્શન કર્યું. તેને મિલ્ક ઓફમાં ઘણા રન બનાવ્યા. જે બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ શ્રેયસ ઐયરની પ્રશંસા કરી અને તેને ટુર્નામેન્ટનો સાયલન્ટ હીરો ગણાવ્યો. ટુર્નામેન્ટમાં, શ્રેયસ ઐયરે બંબાવેદાર સામે 15, પાકિસ્તાન સામે 56, ન્યુઝીલેન્ડ સામે 79, ઓસ્ટ્રેલિયા સામે 45 અને ઈંગ્લેન્ડમાં ન્યુઝીલેન્ડ સામે 48 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે ગયા સિઝનમાં ક્લેકકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરી હતી.

યુઝવેન્દ્ર ચહલથી નાબુશ છે આરજે માહવારા?

(એજન્સી) મુંબઈ | આરજે માહવારા હાલમાં ચર્ચામાં છે. આરજે સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ છે અને પોતાના કેન્સ સાથે પોતાના વિશે અપરેટ્સ શેર કરતી રહે છે. છેલ્લા કેટલાક સપ્તાહથી, આરજે માહવારા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. આ દરમિયાન, હવે આરજેએ કંઈક એવું શેર કર્યું છે જે તેના ઈયરે તેને ફરીથી ચર્ચામાં આવી છે. હવે તેને વિચારતા હશે કે આરજે માહવારા શું શેર કર્યું છે? આરજે માહવારા તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરી પોસ્ટ કરતી વખતે, આરજે માહવારા ફ્લાઈટમાંથી પોતાનો ફોટો શેર કર્યો છે. આ પોસ્ટ રોક કરતી વખતે, આરજે માહવારા કેપ્શનમાં લખ્યું કે બાળક તેની પાછળ બેઠો, આપો રસ્તો ચાલ્યો અને તેના ઈયરે તેને તે તેના માતાપિતાની સામે કેક રહેવું પડ્યું 'અરે કમ છો હી હી'. હવે લોકો આરજે માહવારાની આ પોસ્ટ વિશે વાત કરી રહ્યા છે. કેન્સ આ પોસ્ટને યુઝવેન્દ્ર ચહલ સાથે જોડી રહ્યા છે. આરજે માહવારા તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025



ની ફાઈનલ મેચમાં જોવા મળી હતી. આ દરમિયાન તે યુજ્ઞ ચહલ સાથે જોવા મળ્યો હતો. આ મેચની આરજે માહવારા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી છે. જેની ઈન્ટરન્ટ પર ખુબ ચર્ચા થઈ હતી અને યુઝવેન્દ્ર પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી. તમને જણાવી દઈએ કે એવી ચર્ચા છે કે તે બંને રોશનનરિયામાં છે. પરંતુ બંનેમાંથી કોઈએ પણ આ ચર્ચાઓની પુષ્ટિ કરી નથી કે પ્રતિક્રિયા આપી નથી. પરંતુ આરજે માહવારા એક વખત એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેને કહ્યું હતું કે જો કોઈ છોકરો અને છોકરી સાથે જોવા મળે છે, તો તેમની વચ્ચે કંઈક થઈ રહ્યું છે અને તેને યુઝવેન્દ્ર ચહલ સાથે પેટિંગની ચર્ચાઓને ફગાવી દીધી હતી અને હવે તે બંને કરી સમાચારમાં છે.

યોગી આદિત્યનાથે રિષભ પંતને આપી સ્પેશિયલ ગિફ્ટ



(એજન્સી) મુંબઈ | તા. 19

IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પહેલી મેચ RCB અને KKR વચ્ચે રમાશે. આ વખતે લખાનો સુપર જાનરેશન તેમના નવા કેપ્ટનના નેતૃત્વમાં રમશે. LSG એ આખામી સિઝન માટે તૈયમ પાતેને જવાબદારી સોંપી છે. IPL 2025 પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રિષભ પંતને એક પાસ બેટ આપી છે. જેની તસવીર સામે આવી છે. સીઝનની શરૂઆત પહેલા લખાનો સુપર જાનરેશન લગભગ તૈયમ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ટીમ માલિક સંજય ગોએલ્કા યોગી આદિત્યનાથને મળ્યા હતા, જેની તસવીર પણ જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાન યોગી આદિત્યનાથે કેપ્ટન રિષભ પંતને એક પાસ બેટ પણ શેર કરી. રિષભ પંતે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. તેને ગિફ્ટનો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો. પંતને ભગવાન રામની પ્રતિમા વિષ્ટે તરીકે મળી છે. ઘણા વર્ષો સુધી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરનાર પંત હવે I.S.G.ને નેતૃત્વ કરશે કારણ કે તેને આગામી સીઝન માટે 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને LSG ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો. પંત આઈપીએલમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

હાર્દિક પંડ્યા નહીં બને કવે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન?

(એજન્સી) મુંબઈ | ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનનો પ્રારંભ 22 માર્ચથી થશે. IPL 2025 ની પહેલી મેચ ક્લેકકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. આ સિઝનમાં, મુંબઈ ઈન્ડિયન્સ ટીમ 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પોતાની પહેલી મેચ રમશે. હાર્દિક પંડ્યા આ મેચમાં રમશે નહીં. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા પર એક IPL મેચનો પ્રતિબંધ છે. આ કારણોસર, તે IPL 2025 ની પહેલી મેચ રમી શકશે નહીં. આ જ કારણ છે કે તે ન તો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રહેશે અને ન તો ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ઘેડીંગ ઈલેવનનો ભાગ રહેશે. હાર્દિક પંડ્યા પર એક એવર રેટના કારણે એક મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ટીમને પીમા ઓવર રેટ માટે તૈયાર વખત હા કટકારવામાં આવ્યો હતો.

ચાલુ મેચમાં ક્રિકેટરનું મોત: રોજા રાખીને ભયંકર ગરમીમાં 40 ઓવર ફિલ્ડિંગ કરી હતી

(એજન્સી) મુંબઈ | ક્રિકેટ જગતમાંથી આચાતજનક સમાચાર આવી રહ્યા છે. ક્રિકેટ મેચ દરમિયાન એક ક્રિકેટરનું નિધન થયું છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાના એડિલેઈડમાં બની છે. દુર્ઘટનાને અલવિદા કહેનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જુનેદ ઝકર પાનની 40 વર્ષીય વયે હતી. હાર્દિક પંડ્યા જેમને જાણવી દઈએ કે શનિવારે જ્યારે તે મેચ રમી રહ્યો હતો, ત્યારે 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. આટલી ઊંચી ગરમીમાં જુનેદે આશરે 40 ઓવર ફિલ્ડિંગ કરી હતી. પરંતુ મેચ દરમિયાન સાંજે 4 વાગ્યાની આસપાસ તેની તબિયત ખરાબ થઈ હતી. અને તે બેભાન થઈ મેદાનમાં જ ઢગી પડ્યો હતો. તે પછી તરત જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ તેને ન બચાવી શકાયો. જુનેદે ઓલ રાઉન્ડરોમાં ક્રિકેટ ક્લબ માટે મેચ રમી રહ્યો હતો. મેચમાં જુનેદે આશરે 7 ઓવર બેટિંગ પણ કરી હતી. આ દરમિયાન તે 16 રન બનાવીને અણખન રહ્યો હતો.



પીવાની મંજૂરી હોય છે. જુનેદની ક્રિકેટ ક્લબ દુબ અક્તર કાસ્ટ કહ્યું કે, અમે આના સ્ટાર મેમ્બર નિયામી ખુબ ડુબી છીએ. મેચ દરમિયાન અચાનક તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ હતી. તેને બચાવવા માટે ડોક્ટરોએ ખુબ જ કશિશ કરી, પરંતુ તેને ન બચાવી શક્યા. તેમના પરિવાર, મિત્રો અને ટીમના સાથીઓ સાથે અમારી સંવેદના છે.'

ઇતિહાસમાં કાળા પાને લખાયા વિવાદ જેન્ટલ મેન ગેમને બંદનામી કરી

આ ભય અને મોટી ટુર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત લલિત મોદીએ કરી હતી. આ માટે તેણે પૂરો પ્રયાસ કર્યો. પરંતુ લલિત મોદીને પ્રથમ ત્રણ સિઝન પછી બહાર કરી દેવામાં આવ્યો હતો. લલિત મોદી પર IPL ની નાણાકીય બાબતોમાં ગેરરીતિ કરવાનો आरोप હતો. જેના કારણે તેને લીગમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. લલિત મોદીને રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની ટીમની શરૂઆત હરાજી, સોની સાથે શ્રોક્કસ્ટ ઈલેવન ઈન્ટરવિડી સહિત 5 મોટા કેસમાં આરોપી ગણવામાં આવ્યો હતો.

This is a public announcement for information purposes only and is not a prospectus announcement and does not constitute an invitation or offer to acquire, purchase or subscribe to securities. This public announcement is not intended for publication or distribution, directly or indirectly outside India

DESCO INFRA TECH LIMITED

CIN: U54201GJ2011PLC063710

Our Company was originally incorporated under the name "Desco Infra Tech Private Limited" under the provisions of the Companies Act, 1956 vide Certificate of Incorporation dated January 19, 2011, issued by the Registrar of Companies Gujarat. Subsequently, the status of the Company was changed to public limited and the name of our Company was changed to "Desco Infra Tech Limited" vide Special Resolution passed by the Shareholders at the Extra Ordinary General Meeting of our Company held on June 01, 2024. The fresh certificate of incorporation consequent to conversion was issued on July 26, 2024, by Centralised Processing Centre. For further details on incorporation and registered office of our Company, see "History and Certain Corporate Matters" beginning on page 190 of the Red Herring Prospectus.

Registered Office: A-703, Swastik Universal, Next to Valentine Theatre, Dumas Road, Umra, Surat, Gujarat- 395007 India;
Tel: +91 7574 999 097 | E-mail: investors@descoinfra.co.in | Website: www.descoinfra.co.in
Contact Person: Ms. Gandharva Javanka, Company Secretary and Compliance Officer

THE PROMOTERS OF OUR COMPANY ARE MS. INDIRABEN PRUTHUBHAI DESAI, MR. PANKAJ PRUTHU DESAI, MS. HINA PANKAJ DESAI, MR. MALHAR P DESAI AND MR. SAMARTH PANKAJ DESAI

THE ISSUE

PUBLIC ISSUE OF 20,50,000* EQUITY SHARES OF FACE VALUE OF ₹10.00 EACH (THE "EQUITY SHARES").

*Subject to finalisation of basis of allotment.

DETAILS OF THE SELLING SHAREHOLDERS, OFFER FOR SALE AND WEIGHTED AVERAGE COST OF ACQUISITION

Not Applicable as the entire issue constitutes fresh issue of equity shares.

PRICE BAND: ₹ 147.00 to ₹ 150.00 PER EQUITY SHARE OF FACE VALUE OF ₹ 10.00 EACH

THE FLOOR PRICE IS 14.7 TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES AND THE CAP PRICE IS 15.0 TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES.

THE PRICE TO EARNING RATIO BASED ON DILUTED EPS FOR FY 2023-24 AT THE FLOOR PRICE IS 21.15 TIMES AND AT THE CAP PRICE IS 21.58 TIMES.

BIDS CAN BE MADE FOR A MINIMUM OF 1,000 EQUITY SHARES AND IN MULTIPLES OF 1,000 EQUITY SHARES THEREAFTER.

ISSUE PROGRAM

ANCHOR BID/ISSUE OPENS ON: FRIDAY, MARCH 21, 2025

OPENS ON: MONDAY, MARCH 24, 2025

CLOSES ON: WEDNESDAY, MARCH 26, 2025

Our Company is mainly engaged in providing infrastructure and maintenance services to city gas distribution divisions in India. We engage in activities such as pipeline laying, installation, testing, erection and commissioning for Piped Natural Gas (PNG) utilized by both domestic and commercial users and in its operation and maintenance services. Our Company has recently begun offering services in the power distribution projects relating to connectivity, commissioning, and erection of Low Tension (LT) and High Tension (HT) cables, in water distribution projects by offering by designing and constructing water distribution networks, open wells, sump wells, overhead tanks, and well systems and in the renewable energy sector by providing erection of reinforced concrete (RCC) piles for foundational and structural support, along with the installation of structures and solar modules for energy capture.

THE ISSUE IS BEING MADE THROUGH BOOK BUILDING PROCEDURE, IN ACCORDANCE WITH CHAPTER IX OF THE SEBI ICDR REGULATIONS (IPO OF SMALL AND MEDIUM ENTERPRISES) AND THE EQUITY SHARES ARE PROPOSED TO BE LISTED ON SME PLATFORM OF BSE LIMITED."

THE EQUITY SHARES OF THE COMPANY WILL GET LISTED ON SME PLATFORM OF BSE LIMITED. FOR THE PURPOSE OF THE ISSUE, THE DESIGNATED STOCK EXCHANGE SHALL BE BSE.

ALLOCATION OF THE ISSUE	
QIB PORTION	NOT MORE THAN 50.00% OF THE NET ISSUE
RETAIL PORTION	NOT LESS THAN 35.00% OF THE NET ISSUE
NON-INSTITUTIONAL PORTION	NOT LESS THAN 15.00% OF THE NET ISSUE
MARKET MAKER PORTION	UPTO 1,07,000 EQUITY SHARES OR 5.22 % OF THE ISSUE

IN MAKING AN INVESTMENT DECISION, POTENTIAL INVESTORS MUST ONLY RELY ON THE INFORMATION INCLUDED IN THE RED HERRING PROSPECTUS AND THE TERMS OF THE ISSUE, INCLUDING THE RISKS INVOLVED AND NOT RELY ON ANY OTHER EXTERNAL SOURCES OF INFORMATION ABOUT THE OFFER AVAILABLE IN ANY MANNER.

The price band is justified based on the qualitative factors, quantitative factors and KPIs disclosed in the chapter titled "Basis for Issue Price" beginning on page 129 of Red Herring Prospectus.

CORRIGENDUM TO THE RED HERRING PROSPECTUS DATED MARCH 17, 2025 FILED WITH THE REGISTRAR OF COMPANIES, AHMEDABAD AND SUBMITTED TO SME PLATFORM OF BSE LIMITED (BSE SME) AND SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (SEBI) OF DESCO INFRA TECH LIMITED

In this regard, please note the following:

Under the heading "RISK FACTORS" on the risk factor no. 30 on the Page No. 61 of the Red Herring Prospectus, the first paragraph of the said risk factor shall be read as: We intend to use the Net Proceeds for the purposes described in the section titled "Objects of the Issue" on page 116 of this Red Herring Prospectus. The Objects of the Issue comprises of funding of capital expenditure requirements of our Company towards setting up of corporate office in Surat, Gujarat, funding of capital expenditure requirements of our Company towards purchase of machineries, funding working capital requirements and general corporate purposes. We intend to deploy the Net Proceeds in FY 2025-26, such deployment is based on certain assumptions and strategy which our Company believes to implement in future. The funds raised from this issue may be used on account of change in assumptions, market conditions, strategy of our Company, etc., for further details on the use of the Net Proceeds, please refer chapter titled "Objects of the Issue" beginning on page 116 of this Red Herring Prospectus.

Under the heading, "OBJECTS OF THE ISSUE- PROPOSED SCHEDULE OF IMPLEMENTATION AND DEPLOYMENT OF THE NET PROCEEDS" on the Page No. 117 of the Red Herring Prospectus, the table shall be read as:

The Net Proceeds of the Issue ("Net Proceeds") are currently expected to be deployed in accordance with the schedule as stated below:

Sr.	Object	Estimated Amount to be financed from Net Proceeds*	Estimated Utilization of Net Proceeds in FY 2025-26*
1.	Funding of capital expenditure requirements towards setting up of corporate office in Surat, Gujarat	104.29	104.29
2.	Funding of capital expenditure requirements towards purchase of machineries	168.04	168.04
3.	Funding Working Capital Requirements of our Company	1,800.00	1,800.00
4.	General corporate purposes*	0	0
	Total	0	0

*The amount utilized for general corporate purpose shall not exceed 25% of the gross proceeds of the issue.

*To be updated in the Prospectus prior to filing with RoC.

Under the heading, "OBJECTS OF THE ISSUE- PROPOSED SCHEDULE OF IMPLEMENTATION AND DEPLOYMENT OF THE NET PROCEEDS" on the Page No. 117 of the Red Herring Prospectus, the second paragraph shall be read as:

Our Company proposes to deploy the entire Net Proceeds towards the aforementioned Objects during Fiscal 2025-26. In the event that the estimated utilization of the Net Proceeds in scheduled fiscal year is not completely met, due to the reasons stated above, the same shall be utilized in the next fiscal year i.e., 2026-27, as may be determined by the Board, in accordance with applicable laws. If the actual utilization towards any of the Objects is lower than the proposed deployment, such balance will be used towards general corporate purposes. To the extent that the total amount to be utilized towards general corporate purposes is within the permissible limits in accordance with the SEBI ICDR Regulations, in case of a shortfall in raising requisite capital from the Net Proceeds or an increase in the total estimated cost of the Objects, business considerations may require us to explore a range of options including utilising our internal accruals and seeking debt funds. In furtherance, that such alternate arrangements would be available to fund any such shortfalls. Further, in case of variations in the actual utilization of funds earmarked for the purposes set forth above, increased fund requirements for a particular purpose may be financed by surplus funds, if any, available in respect of the other purposes for which the funds are being raised in the issue, subject to compliance with applicable laws.

Under the heading, "OBJECTS OF THE ISSUE- DETAILS OF THE OBJECTS OF THE ISSUE" on point - 1. Funding of capital expenditure requirements towards setting up of corporate office in Surat, Gujarat, on the Page No. 119 of the Red Herring Prospectus, the date of payment for purchasing the proposed corporate office shall be updated in the table as: On or before April 10, 2025.

Under the heading, "OBJECTS OF THE ISSUE- DETAILS OF THE OBJECTS OF THE ISSUE" on point - 3. Funding Working Capital Requirements of our Company, on Page No. 122 of the Red Herring Prospectus, the first paragraph of the Basis of estimation of incremental working capital requirements of our Company shall be read as:

Our Company proposes to utilize ₹1,800.00 Lakhs of the Net Proceeds in Fiscal 2025-26, respectively towards our Company's working capital requirements. The balance portion of our Company's working capital requirement shall be met from the working capital facilities availed and internal accruals.

Under the heading, "OBJECTS OF THE ISSUE- DETAILS OF THE OBJECTS OF THE ISSUE" on point - 3. Funding Working Capital Requirements of our Company, on Page No. 123 of the Red Herring Prospectus, the funding pattern as mentioned in the table shall be read as:

	Audited	Audited	Audited	Provisional	Provisional		
Sr. No	Particulars	FY 21-22	FY 22-23	FY 23-24	Period ended September 30, 2024	FY 24-25	FY 25-26
IV	Funding Pattern						
	IPO Proceeds	---	---	---	---	---	1,800.00

Accordingly, the Red Herring Prospectus, shall stand amended to the extent of and should be read with the above.

The relevant changes shall be reflected in the Prospectus.

All capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the Red Herring Prospectus dated March 17, 2025

For Desco Infra Tech Limited
Sd/-
Mr. Pankaj Pruthi Desai
Designation: Chairman and Managing Director
DIN: 03344685

Date: March 19, 2025
Place: Surat

AudBaz